

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ

			
www.jau.in	www.aau.in	www.nau.in	www.sdau.edu.in

ઘોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો (એ-ગ્રુપ)માં ઓનલાઇન

કેન્દ્રિય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧

ગુજરાત રાજ્યની આણંદ, જૂનાગઢ, નવસારી તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં ઘોરણ-૧૨માં (વિજ્ઞાન પ્રવાહ સાથે) ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના **એ-ગ્રુપના (Physics, Chemistry and Mathematics)** જ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે વેબસાઇટ www.gsauca.in/ a.gsauca.in અને www.jau.in દ્વારા **તા.૧૫/૦૯/૨૦૨૦ થી તા.૨૮/૦૯/૨૦૨૦** દરમિયાન ડેડીટ કાર્ડ/કેબીટ કાર્ડ/ઓનલાઇન નેટ બેન્કીંગ દ્વારા અરજી ફી પેટે રૂા. ૨૦૦/- ભર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઇન થશે.

પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી [www.gsauca.in / a.gsauca.in](http://www.gsauca.in/) અને www.jau.in પરથી મેળવી શકાશે. સદર કાર્યક્રમની તારીખોમાં ફેરફાર ને અવકાશ હોઇ જે અંગેની અધ્યતન માહિતી ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે. હવે પછી પ્રવેશ કામગીરી અંગેની કોઇપણ જાહેરાત આપવામાં આવશે નહીં. જેની વાલી/વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી.

“A” ગ્રુપના સંલગ્ન અભ્યાસક્રમો	PCM (A-Group)	અરજી ફીની રકમ
• B.Tech. (Dairy Technology)		રૂા. ૨૦૦/-
• B.Tech. (Agricultural Engineering)		
• B.Tech. (Food Technology)		
• B.Tech. (Renewable Energy & Environmental Engineering)		
• B.Tech. (Agricultural Information Technology)		

નોંધ: PCM = Physics, Chemistry and Mathematics

અગત્યની સૂચના

- (૧) સદર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે GUJCET આપેલ હોવી જરૂરી છે.
- (૨) વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.
- (૩) સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઇન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. **માહિતી પુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ઓનલાઇન ફોર્મ ભરવું.**
- (૪) ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ વેરીફિકેશન પણ ઓનલાઇન જ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરીયાત નથી.
- (૫) **ફોર્મ વેરીફિકેશન થયા બાદ ચોઇસ ફીલીંગ કરવું ફરજીયાત છે.** જે વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલીંગ નહીં કરેલ હોય તેઓનું નામ મેરીટ યાદીમાં સમાવેશ થશે નહીં.
- (૬) ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો તેમજ વખતો વખતની અન્ય વધુ માહિતી મેળવવા માટે વેબસાઇટ a.gsauca.in ના સતત સંપર્કમાં રહેવું.

તા. ૧૨/૦૯/૨૦૨૦

કુલપતિ અને નોડલ અધિકારી (એ-ગ્રુપ પ્રવેશ)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ